

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૭/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૫૪/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૨૪૮ લીટર દેશી દારૂ, ૧૮૭ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૮ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૨૯૦ બિયર ટીન, ૧ રિક્ષા, ૧ સ્કૂટર અને ૨ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૨,૨૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૫૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૩૫૬/૧૮

કાઈમ બ્રાન્ચ: યોગેન્દ્રકુમાર ગોવિંદલાલ પટેલ (ઉવ.૨૨) (રહે.પુર્વી ટાવર સુભાષચોક મેમનગર) એ તા.૧૬/૭/૧૮ નારોજ કાઈમ બ્રાન્ચ ખાતે ફરીયાદ નોંધાવી છે કે સી.જી.રોડ સ્વાગત બીલ્ડીંગ ખાતે આરોપી અમૃતલાલ બબલદાસ પટેલ (રહે. સુરધારા બંજ્લોઝ થલતેજ) એ તા.૩૦/૦૪/૨૦૧૭ નારોજ પ્રોમેસરી નોટ લખી આપી સમજૂતી કરાર મુજબ રૂપિયા ૧૧ કરોડ પેટે વડોદરામા આવેલ જમીનનો એક ટકા ભાગ તથા રૂપિયા ૩,૫૦,૦૦,૦૦૦/- નો ચેક આપેલ જે ચેક તા.૧૫/૦૭/૨૦૧૭ નારોજ યોગેન્દ્રકુમાર પટેલના આઈ.ડી.બી.આઈ બેંક મેમનગર બ્રાંચ ખાતે ભરતા ચેક ક્લીયર નહી થતા જાણવા મળેલ કે અમૃતલાલ પટેલે તેમના એચડીએફસી બેંક ખાતામા સ્ટોપ પેમેન્ટ કરાવી યોગેન્દ્રકુમાર પટેલ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ જે.એમ.પટેલ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૫૭/૧૮

ચાંદખેડા: જબ્બરસિંહ ભાટીભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) (રહે. સવિતાનગર વિસત ગાંધીનગર હાઇવે મોટેરા ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૭/૧૮ બપોરના ૨/૧૫ વાગ્યાના સુમારે ચાંદખેડા મોટેરા ગાંધીનગર હાઇવે અશોકવિહાર સર્કલ હેવમોર શોપ પાસે પોતાના મોટર સાયકલના હુકમાં ભરાવેલ બેગની અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ હતી. જે બેગમાં રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.એસ.ચૌધરી ચલાવે છે.

ઈસનપુર: મહમદ પરવેઝ સાબીરમિયા રાહોડ (ઉ.વ.૩૯) (રહે. ગામ-પ્રાંતિજ તા.-પ્રાંતિજ જી-સાબરકાંઠા) એ તા.૧૬/૭/૧૮ નારોજ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૭/૧૮ સાજના ૫/૩૦ થી ૬/૧૫ વાગ્યા દરમિયાન ઈસનપુર શાહઆલમ દરગાહ અંદર મહમદ પરવેઝ રાહોડના પત્નીની નજર ચુકવી પર્સમાંથી સોનાનો સેટ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, સોનાની બુટ્ટી કિંમત રૂપિયા ૧૧,૦૦૦/- અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૦૦૦/- મતાની અજાણી વ્યક્તિએ ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એમ.ચાવડા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૫૮/૧૮

નરોડા: દલસુખભાઈ કસનાભાઈ મેડા (રહે.લક્ષ્મી સ્કાય સીટી નામની નવી બનતિ સાઇટ ઉપર મહાકાળી પેટ્રોલ પંપની પાસે, દાસ્તાન સર્કલ પાસે, રિંગ રોડ, નરોડા) એ તા.૧૦/૭/૧૮ સાજના ૭/૦૦ વાગે રહેણાંક નજીક મહીન્દ્રા મેક્સ પીક અપ ડાલુ ગાડી નંબર જીજે ૭ ટીટી ૯૧૪૪ કિંમત રૂપિયા ૧,૩૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૧/૭/૧૮ કલાક ૬/૦૦ વાગ્યા દરમિયાન થઈ હતી. આ અંગેની ફરીયાદ દલસુખભાઈ મેડાએ તા.૧૬/૭/૧૮ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.આર.બામણિયા ચલાવે છે.

પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૩૫૯/૧૮

નારોલ: રાહુલકુમાર સન/ઓફ સુનીલ પાસવાન (ઉ.વ.૨૩) (રહે. દેવાભાઈ ભરવાડની ચાલી પીપળજ નારોલ) તા.૧૬/૭/૧૮ સવારના ૮/૧૫ વાગ્યાના સુમારે નારોલ પીપળજ ખાતે આવેલ વી.આર. પોલીફેબ (સિધ્ધાંત ફેશન) પ્રા.લી.કંપનીમાં કામ કરતા હતા ત્યારે અચાનક નીચે પડી જતાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પ્રો.એ.એસ.આઇ.શ્રી બ્રીજરાજસિંહ દીલીપસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૩૬૦/૧૮

સાબરમતી: ખેમચંદ રામલાલ રાજપુત (ઉ.વ.૫૨) (રહે. તપોવનની ચાલી સીટી ગોલ્ડ સીનેમાની સામે મોટેરા રોડ સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૧૩/૭/૧૮ સવારના ૧૦/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.૧૬/૭/૧૮ બપોરના ૩/૨૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી શનાભાઈ ધુળાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.